## **No Calls Seeking More Advance Tax, Revenue Secy Assures Cos**

THE ECONOMIC TIMES | AHMEDABAD | THURSDAY | 12 AUGUST 2021 | WWW ECONOMICTIMES

Bajaj asks India Inc to revive 'animal spirits', increase pyt investment aggressively

Guiveen.Aulakh@timesgroup.com

 Wrethen her in the investion of the services may calls
 New Dohlin in the investion of the services may calls
 New Dohlin in the investion of the services may calls
 Surring the industry of a "stable and predictable services the intermediated black to post the services may calls
 Council would look at solutions to bring dowrmanic services the intermediate services the service service the intermediate services the service service the services the services the service service the services the services the service service the services the services the services the services the service service the services the services the service service the services the service service the services the service service the services the services the services the services the services the services the service service the services the serv w Delhi: India Inc will not meeting any calls

lakh crore, as against over Rs 1.17 lakh crore col-lected during the same period lastfiscal (2020-21). Bajaj also sought to know from the industry the stops of support that the government can provi-de

**Tata Group to Close Flagship** 

# Fund, Realign PE Business

### Kala Vijayraghavan &

Mumbai: The Tata Group is understood to be realigning its private equity business and is consolidating all its future li-mited partner commitments

funds — Tata Capital Growth Fund and Tata Capital Health-

rund and raak appear reading turn bend has quite reading The opportunity fund's cur-ernt term will end in March 40 edivoticontinues sonsoring 2022 and it can further be es-tended by another year; a Tata sons spokesperson stild sepa-manabh (Faddy) Sinha hadqui 

### Nitin Gadkari to Meet **RBI Governor to Discuss Infra Funding Ideas**

Dur Bureau am ready to make some new system to use foreign invist-minister Nitro addari will minister Nitro addari will ministry Nitro an objectic som approach the Reserve Bankof rinda no suggestons to use India's foreign reserve some new setter to use foreign invest some new setter to use to us ture. Gadkari, who is the minister for road transport and high-

eaking at e Confede-tion of Indian Indus:-ry Annual session 2021 on Wednes-

on We. day. "We have a "lus of "ser surplus of dollar reser-ves in the co-untry," Gad-kari said.

kari said. "I am going to talk with the Reserve Bank gover-nor about how we can formulate a formulate a policy whe-reby we can use these fo-reign ex-change re-serves for deve frastruct 1.4

change re-serves for development of in-fractructure in the country at a low cost," he said. Gadkari said his ministry is also open to formulating new jonicies for bringing in for ign investment in highway construction

construction. He added that the National He added that the National more effective implementa-media financial institutions on GPD issues of the theory of the media financial institutions on GPS haved solling. God for infrastructure projects. Three months, the technology "If there are some foreign in-text of the technology of the technology of the technology extens who are ready to in-vest in read-construction and which is going to save us loom in dollars but hedging travel hasde-free for the com-will be their repositebility.

Bugging the Data Statistical Market Mar

collaboration with the Tata Group. The decision to close the fund has led to the exit of executives from the firm. In one of the la-test rounds, Bohly Pauly, ma-naging partner of Tata Oppor-tunities Fund and an old Tata

### India to Attend Afghan Peace Talks in Doha Today

₹**1**∧

GMDC

CONSULTANT

**TO MINE DEEPER** 

**OPPORTUNITIES.** 

SEEKING A STRATEGY

Gujarat Mineral Development Corporaton Ltd. (GMDC), is one of India's leading mining and mineral processing companies. Rarked 132<sup>24</sup> among India's Fortune 500 companies (2017), and in top 5 by market capabilisation in the mining sector, we are a debt-free company besides being a major player in mining lighte & other valuable minerals, our powerful portfolic comprises of a lighte-based thermal power plant along with wind and solar power installations.

Contra A

 DipanjanRey.Chaudhury (EfferStrüdD4Com getterStrüdD4Com
 and pirt secretary (Pakistan-Atganis-inst-ran) in the MEA, JP. Singh, are ex-pected to present. New Dolhi in the ange the present. New Dolhi in the ange the present New Dolhi in the ange the present. New Dolhi in the ange the present New Dolhi in the ange the present. New Dolhi in the ange the present New Dolhi in the Alghan servers of New Dolhi in the Alghan servers of New Dolhi in the Alghan servers of New Dolhi in the New Dolhi

#### Hawkins Cookers Limited

Registered. Office.: Maker Tower, F101, Cuffie Parade, Mumbai 400005 CIN: L28997MH1959PLC011304 'el: 022-22186607 Fax: 022-22181190 E-mail: ho@hawkinscookers.com Website: www.how.html Hawkins Tel

NOTICE FOR TAX DEDUCTION AT SOURCE ON INTERIM DIVIDEND A the loss has been deal as the second of the second as th

The Company is required to deduct tax at source (TDS) at the time of making payment of the said Interim Dividend, as applicable, under the Income Tax Act, 1961.

2. The Company's required to deduct this at source (1D). at the time of making payment of the said Interim Dividend, as applicable, under the Ircome 1 as Art, 1901.
5. Shareholders who wish to submit the required documents for no or reduced 113s are requested to refer theya/www.haw(inscorkers.com/download/Notice com/download/Notice but no later than August 18, 2021. Please contact coce@haw(inscorkers.com/assistance.

Mumbai For Hawkins Cookers Limited August 11, 2021 Hutoxi Bhesania, Company Secretary

### AIA ENGINEERING LIMITED

Ð (CIN: L29259GJ1991PLC015182)
 Regd: Office: 115, GVMM Estate, Odhav Road, Odhav, Armedabad - 382 4
 Website: <u>www.alsengineering.com</u>; E-mail: <u>irc/exalaengineering.com</u> Phone: 079-22901078, [as: 075-22901077 ad - 382 410

### NOTICE OF 31ST ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK-CLOSURE

E-VOTING INFORMATION AND BOOK-CLOSURE Notice is hereby given that the 31st Annual General Meeting (ADM) of the company is cabuladed to be had on rided, the 3d September 2011 at 10.00 a.m. through Visioo Conference (VOL Other Lukov Sussi Means (DVM), to threas at the Orientary and Special Burnesses, as set out in the Notice of the 3 st AdMin compliance with Circuit No. 142020 dated April 6, 2220, Orozan ho. 17/2020 dated April 3, 2020, Circuitar No. 2020/2020 dated April 6, 2020, Orozan ho. 17/2020 dated April 3, 2020, Circuitar No. 2020/2020 dated April 6, 2020, Ministry of Corporate Afritis and site: Circuitar No. SEBHHOTOPCONDICRP/2020/78 dated May 12, 2020 and circuitar No. SEBHHOTOPCONDICRP/2020/78 dated May 15, 2021 issued by the Securities and Circuitar Circuitar May 16, 2021 history of pository Participant(3) The Motice of AdM ainage with the Annual Report for Financial Yaar 2032-2021 can be downliaded from the website of the Campany Wawaiiaandingering com and westism of Circuitar Aussering and and wavan sinsitiance, can end wester and and Austoria Book Kernhage No. Services (Inda) Limited (CoSL); www.cotingindia.com. Humot E-Vorom gate L-Vorot agritury AdM.

Remote E-Voting and E-Voting during AGM:

Remote I-vieling and I-vicining during AGM: Persiant to the provisions of section 100 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Nature") assammedia, and Regulation 4 of GEI (Linko Oblagions and Dacksoure Requirements) Regulations, 2015, the Company is providing to moments, the fact linkow and the Nature Administration of the Company through the remote a-wing handling provided by CGS. The detailed AGM which has been exit to the remoters and the Company in Action AGM which has been exit to the remoters.

The detais pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules are given hereunder: 1. Cut off date for the purpose of remote a voting : Friday, 27th August,

Date and time of Commencement of remote e-voting : Frem Monday, 30th August, 2021 at 09:00 a.m.

30th August. 2021 at 09.30 am. Date and time of end formote a-working light Thursday. 2nd September. 2021 at 05.00 p.m. Femote e-working shall not be allowed beyond the said time and date. Those Memberso, who shal be present in the AGM through VC/OAMM facility and had not cast their routes on the resolutions and allo be allowed and said the said through voltage and Members with harm east their works by immore avoiding onit on the AGM case also attendynamic pairs in the AGM through VC/OMM but shall be sentitive to sait their works given and works vC/OMM but shall be be entitive to sait their works given and works works works and the sait of the be entitive to sait their works given and the sait the sait of the sait their works given and the sait the sait the sait their sait their works given the sait their works given their sait their works given the sait their works given the sait their works given the sait their works given their sait their works given the sait their works given their works given the sait their works given the sait their works given their works given the sait their works given their sait their works given their sait their works given their sait t

Persons who have acquired shares and become members of the Company after displation of the Notice of the AcMI and holding shares as on the cut-off date 1.8. 27th August, 2021 may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the ACM.

Instructions and process of remote 6 voting as provided in the Notice of the AGM. 5. A person whose name is recorded in the register of members or in the register of heneficial swamer maintained by the depositions as on the cut-off data only, shall be entitled to avail the facility of remote e-velting swell as e-velting in the AGM. 5. The manner of remote e-velting and e-voting during the AGM for shareholders holding shales in dimansilized mode physical mode and for shareholders holding shales in dimansilized mode physical mode and for shareholders holding shales in dimansilized mode physical mode and the shareholders holding shares in dimansional addresses has been in a for the holding instructions are called and the shareholder holding shares in Demonstrates e-mail addresses with the minimal addresses with the holding instructions to registrice during and the shareholder holding in the AGM. 5. Proceeding the share in the holding instructions to registrice of the relation of the AGM for the AGM

23355842 or 022-23055543 All opionaes contractivitit this facility for voting by a settorsic means can be addressed to the "Askan buik Sr Manage Cotta Depositors services (real) Linear Manage Manage Cotta Depositors Mills Compound, N. M. Josh Mang, Lover Parel (East), Mambai - 400 013 or send are are mail to helphate settorilly Gobalinaia com or call 022-23368738 / 022 23058543 / 022 23058542.

Is longer to get the divergence of the consistence of the bank account of the members, the members holding shares in physical mode can provide ser-afsets doogs of PNL Card. Adara Card. Canceled Chaque and passhook alongering that card, adara Card. Canceled Chaque Membor: The members holding shares in dmain ford, can appread their depository participant with when they hold the demal account.

Narsuant to the provisions of Section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer Book of the Company will remain bood from Saturding, 28th August 2021 to Friday, 3rd Soptembor, both days inclusive) for the purpose of AGM and to determire the list of members entitled to receive div derd. For AIA Engineering Limited. Sd/-(S. N. Jetheliya) Company Secretary

Date: 11th August, 2021 Place: Ahmedabad

els.	Net Profit / (
"Don't use	
diesel as fu-	Net Profit / (
el, that's my recuest to	2. The abo
all contrac-	ended .
tors," he sa-	
tors," he sa- id.	(Listing
Gadkari	the Qua
l out bureau-	
the system.	website
system in the	www.as
orthodox, con-	
not ready for	3. The ab
said.	approve
such attitudes	approve

must change for faster more effective implem enta.





further pointe-cratic delays in "The present hange," h

Place : Ahmedabad

- se.life respectively. ove financial results have been reviewed by the Audit Committee and and ed by the Board of Directors at their meeting held on 11th August, 2021.
- These results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the

extent applicable. For, Ambalal Sarabhai Enterprises Limited

Chairman Date : August 11, 2021 Kartikeya V Sarabhai

REQUEST FOR (RFP)

( t in Lakhs)

T

As GMDC embarks on a journey of growth and value creation, we seek the strong expertise of a wolf-class strategy consultant, with deep experience & portfolo in mining success stories. Through their global understanding of miniratia and the mining sector, they will help assess and create multiple strategies for future growth.

The consulting firm must be a company registered in India with at least one office in the country.

GMDC invites proposals from strategy consultants (No. GMDC/BD/01/2021-22)

Gujarat Mineral Development Corporation Ltd.

Khanij Bhavan, 132 Feet Ring Roac, Near University Ground, Vastrapur, Ahmedabad - 380 052

## ase° Ambalal Sarabhai Enterprises Limited

Regd. Office : Shanti Sadan, Mirzapur Road, Ahmedabad-380001 Phone : 25507671, 25507073, Website: www.ase.life, E-mail: ase@sarabhai.co.in EXTRACT OF UN-AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2021 (₹ in Lakhs, except per share data)

Sr.	and the second		Quarter ended				
No.	Particulars	30.06.2021 Un-audited	31.03.2021 Audited	30.06.2020 Un-audited	31.03.2021 Audited		
1	Total Income from Operations	7,346.12	7,376.63	2,827.43	19,422.25		
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	4,373.67	1,617.22	133.38	3,254.07		
3	Net Profit / (Loss) for the period before tax and after exceptional items	2,873.67	1,617.22	133.38	3,254.07		
4	Net Profit / (Loss) for the period after tax and exceptional items	2,659.60	1,559.48	92.99	2,935.35		
5	Total Comprehensive Income for the period {Ccmprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)}	2,647.52	1,584.61	85.63	2,938.12		
6	Paid-up Equity Share Capital (Face Value - Rs.10/- Per Share)	7,663.33	7,663.33	7,663.33	7,663.33		
7	Other Equity as shown in the Audited Balance Sheet of the previcus year				(273.52)		
8	Earnings Per Share (of Rs.10/- each)	3.47	2.03	0.12	3.83		

#### 8 Earnings Per Share (of Rs.10/- each) 3 47 2.03 0.12 Basic and Diluted Earning Per Share (Nct Annualized) (in Rs.) Notes : 1. Key numbers of Standalone Results are as under :

1000 1000 1001 01		Year ended			
Particulars	30.06.2021 Un-audited	31.03.2021 Audited	30.06.2020 Un-audited	31.03.2021 Audited	
Total Income from Operations	3,046.41	2,528.63	150.81	2,961.29	
Net Profit / (Loss) before tax	1,369.52	(898.96)	19.30	(946.81)	
Net Profit / (Loss) after tax	1,373.67	(893.38)	18.09	(938,71)	

June 30, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of arterly Standalone and Consolidated Financial Results are available on the of the Stock Exchange www. bseindia.com and the Company's Website

# ફાયનાન્સિયલ એક્સપ્રેસ

CSL Financ	Regd. Office: 4	SL FINANCE LIN 10-412,18/12, 4th Floor, W.E.A, Arya S 716-717, 7th floor, Tower B, World Tra	Samaj Road, Kar	ol Bagh, New D	elhi-110005 2-201301		Raj		nan State Mines & Minerals Limitec ( A Government of Rajasthan Enterprise )
	(CIN: L74899DL199)	2PLC051462; Tel: 0120-4290654; Em NCIAL RESULTS FOR	ail: info@cslfinar	nce.in; Web: w	w.cslfinance.in		NC	Phone	rporate office-4, Meera Marg, Udaipur (Raj)- 313001 -0294-2428768,2428763-67,Fax-0294-2428768,2428770 
S.				Quarter ende	ł	Year-Ended	NIT No. & Date		Description of Work
No.	Particulars				30-Jun-2020		e-NIT No.14/202		Design, Supply Testing, Erection & Commissioning of All Material
1 Total income from			Un-audited 1560.17	Audited 1707.28	Un audited 1476.17	Audited 6185.96	Dated 06.08.202		Including Lattice Tower For Construction of 11 KV And 3.3 KV
	operations for the period (before tax, E	vcentional and/ or	924.67	1175.69	933.31	3,936.01	UBN No.		Overhead Electric lines at JhamarKotra Mines. Approx Qty
Extraordinary item		coeptional and/or	524.07	1175.05	555.51	3,930.01	MML2122WSOB	00077	As per tender, Bid Security Rs. As per tender,
	for the period before tax (at	fter Exceptional and/ or	924.67	1175.69	933.31	3,936.01		· ·	Tender Document Fee Rs. 1180/-
Extraordinary item	ns)						Other terms & o	conditio	ns have been given in detailed tender for which please visit us at o
	for the period after tax (afte	er Exceptional and/ or	700.67	878.16	702.23	2,752.79	website www.rs	smm.cor	m or www.sppp.rajasthan.gov.in or www.eproc.gov.in or contact DC
Extraordinary item							(MM) on above	address	
		Comprising Profit/ (Loss) for the	700.67	886.37	702.23	2,761.00	Raj.samwad/C/2	21/4623	DGM (Admir
6 Equity Share Capi	and Other Comprehensive	Income (after tax)]	616.92	616.92	616.92	616.92			
		s shown in the Audited Balance	010.92	010.92	010.92	010.92			SALE NOTICE
Sheet of previous									(Extension of date of e-auction)
	re (of Rs.10/- each)								ARMACEUTICAL LIMITED (In Liquidation)
	d discontinued operations)						Regd Offi	ce: 15	96, FF, Bhagirath Palace, Chandni Chowk, Delhi 110006
1. Basic:			11.47	14.50	11.51	45.08	In the Sale Not	tice pub	blished on 13.07.2021 for the sale of assets under the Insolvency
2. Diluted:			11.45	14.47	11.51	44.99			16 and regulations framed thereunder, the date of E-auction w
Regulation 33 (and of the above Financial R	ther Regulations as applicable Results is available on the Stoc	Un-audited Financial Results for the e) of the SEBI (Listing Obligations and k Exchange website – www.bseindia.ct	Disclosure Requ om and on the co	irements) Regu mpany's websit	lations, 2015. T e at www.cslfina	he full format of ance.in.	mentioned as ( 31.07.2021. TI <b>11.00 a.m. to 0</b>	02.08.2 he date 1 <b>2:00 p.</b> 1	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from . (With unlimited extension of 5 minutes each). Accordingly the data
<ol> <li>The above is an extr Regulation 33 (and of the above Financial R</li> <li>The above Un-audit meetings held on Au</li> <li>The above Un-audit</li> <li>Place : Noida</li> </ol>	ther Regulations as applicable Results is available on the Stock ted Financial Results were igust 11, 2021.	e) of the SEBI (Listing Obligations and	Disclosure Requ om and on the cor and approved by	irements) Regumpany's websit the Board of	lations, 2015. T e at www.cslfina Directors at th an Accounting By orc	The full format of ance.in. heir respective Standards. der of the Board Sd/- Rohit Gupta	mentioned as ( 31.07.2021. <b>Ti</b> <b>11.00 a.m. to 0</b> of submission d The details of a 13.07.2021 an The complete	02.08.2 he date 02:00 p. of docur assets a d E auct details	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from (With unlimited extension of 5 minutes each). Accordingly the date ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.2021 and all other terms and conditions as mentioned in sale notice date tion Process Information Document remains unchanged. of the E-auction are available on http://embeeip.com and on times and the sale
<ol> <li>The above is an extr Regulation 33 (and of the above Financial R</li> <li>The above Un-audit meetings held on Au</li> <li>The above Un-audita</li> </ol>	ther Regulations as applicable Results is available on the Stock ted Financial Results were igust 11, 2021.	e) of the SEBI (Listing Obligations and k Exchange website – www.bseindia.cr reviewed by the Audit Committee a	Disclosure Requ om and on the cor and approved by	irements) Regumpany's websit the Board of	lations, 2015. T e at www.cslfina Directors at th an Accounting By orc	The full format of ance.in. heir respective Standards. der of the Board Sd/-	mentioned as ( 31.07.2021. <b>Ti</b> <b>11.00 a.m. to 0</b> of submission d The details of a 13.07.2021 an The complete	02.08.2 he date 02:00 p. of docur assets a d E auct details	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 fro m. (With unlimited extension of 5 minutes each). Accordingly the da ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice data tion Process InformationDocumentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on th on service provider https://ncltauction.auctiontiger.net Sd/-
The above is an extr Regulation 33 (and of the above Financial R . The above Un-audit meetings held on Au.     The above Un-audit Place : Noida Date : 11.08.2021	ther Regulations as applicable desults is available on the Stock ted Financial Results were igust 11, 2021. ed Financial Results have be	e) of the SEBI (Listing Ohligations and KExchange website – www.bseindia.c reviewed by the Audit Committee a reviewed by the Audit Committee a een prepared in accordance with the	Disclosure Requ om and on the co and approved by principles laid do	irements) Regu npany's websit y the Board of own in The Indi	lations, 2015. T e at www.cslfina Directors at th an Accounting By orc (Mar	he full format of ance.in. heir respective Standards. der of the Board Sd/- Rohit Gupta anging Director) DIN: 00045077	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 and The complete website of the e	02.08.2 he date 02:00 p.1 of docur assets a d E auct d E auct details e-auctio	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from (With unlimited extension of 5 minutes each). Accordingly the dements and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on t on service provider https://ncltauction.auctiontiger.net Sale
1. The above is an extr Regulation 33 (and of the above Un-audit meetings held on Au 3. The above Un-audit Place : Noida Date : 11.08.2021	ther Regulations as applicable results is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be	e) of the SEBI (Listing Ohligations and KExchange websile - www.besienda.o reviewed by the Audit Committee a sen prepared in accordance with the 자습고 하) 값값 (니인	Disclosure Requ om and on the cou and approved by principles laid do	irements) Regu mpany's websit y the Board of own in The Indi	Iations, 2015. T e at www.cslfina Directors at th an Accounting By orc (Mar	The full format of ance.in. heir respective Standards. der of the Board Sd/-Rohit Gupta naging Director) DIN: 00045077	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 and The complete website of the o	02.08.2 he date 02:00 p.1 of docur assets a d E auct d E auct details e-auctio	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 fro m. (With unlimited extension of 5 minutes each). Accordinglythe da ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on tl on service provider https://ncltauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE
1. The above is an extr Regulation 33 (and of the above Un-audit meetings held on Au 3. The above Un-audit Place : Noida Date : 11.08.2021 હટાડ્ર ટા	ther Regulations as applicable tesults is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be પ્રદ વેચાણ ની વ ઓ ક શયનાન્સિયલ એસેટ્	e) of the SEBI (Listing Ohlgations and KExchange website - www.bseindia.o. reviewed by the Audit Committee a een prepared in accordance with the <b>Mહેર ઓટીસ (પરિ</b> ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોર્ટ	Disclosure Requ om and on the con and approved by principles laid do principles laid do <b>Rive - x</b> 1.21 St-2222 ab	irements) Regumpany's websit y the Board of own in The Indi own in The Indi	lations, 2015. T e at www.cslfina Directors at th an Accounting By orc (Mar ભારામ ૮ હેઠળ આઇઆ	The full format of ance.in. heir respective Standards. der of the Board Sd/- Rohit Gupta aging Director DIN: 00045077	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 an The complete website of the of	02.08.2 he date 12:00 p.1 of docur assets a d E auct details e-auctio	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Document remains unchanged. of the E-auction are available on http://embeeip.com and on th on service provider https://ncltauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1115
1. The above is an extr Regulation 33 (and of the above Financial Meetingsheld on Audi meetingsheld on Audi Place : Noida Date : 11.08.2021 હિટાહ સા લડાયા અને રીકન્સ્ટ્ર કરાન અગાઉ ઇન્ડિયા અન્ફેલાઇઝ	ther Regulations as applicable kesults is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be હિ વેશાણ ની વ હો સાર માન્સિયલ એસેટ્ ન હો લીસેંગ ફાયનાન્સ લી	e) of the SEBI (Listing Ohligations and kExchange website - www.bseindia.o reviewed by the Audit Committee a een prepared in accordance with the <b>મહેર નોટીસ (પરિ</b> (સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોર્ મીટેડ તરીકે જાણીતી) (આઇઆઇ)	Disclosure Requ om and on the con and approved by principles laid do <b>શાસ્ટ – ૪</b> તેરી ઇન્ટરેસ્ટ એ એ ફએલ એચએ	irements) Regu mpany's websit y the Board of own in The Indi own in The Indi <b>रके) (टि</b> संडे, २००२ <b>इंग्रेस) ना</b> अ	lations, 2015. T a twww.cslfina Directors at th an Accounting By orc (Mar (Mar દોટીમ ડ હેઠળ આઇઆ ધિકત અધિકા:	The full format of ance.in. heir respective Standards. Sdr of the Board Sdr. Rohit Gupta naging Directory DIN: 00045077	mentioned as ( 31.07.2021. TI 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 an The complete website of the a Li	02.08.2 he date 12:00 p.1 of docur assets a d E auct details e-auctio	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Document remains unchanged. of the E-auction are available on http://embeeip.com and on th on service provider https://ncltauction.auctiontiger.net MARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBB/I/PA-002/IP-N00418/2017-18/1113 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002
1. The above is an extr Regulation 33 (and of the above Financial R 2. The above Un-audit meetings held on Au 3. The above Un-audit Place : Noida Date : 11.08.2021 હટા છટ હટા ટ્યા ટ અગાઉ છ-િયા ઇન્ફોલાઇ- અગાઉ ઇન્ડિયા ઇન્ફોલાઇ- અગાઉ ઇન્ડિયા ઇન્ફોલાઇ-	ther Regulations as applicable kesults is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be હિ વેશાણ ની વ હો સાર માન્સિયલ એસેટ્ ન હો લીસેંગ ફાયનાન્સ લી	e) of the SEBI (Listing Ohlgations and KExchange website - www.bseindia.o. reviewed by the Audit Committee a een prepared in accordance with the <b>Mહેર ઓટીસ (પરિ</b> ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોર્ટ	Disclosure Requ om and on the con and approved by principles laid do <b>શાસ્ટ – ૪</b> તેરી ઇન્ટરેસ્ટ એ એ ફએલ એચએ	irements) Regu mpany's websit y the Board of own in The Indi own in The Indi <b>रके) (टि</b> संडे, २००२ <b>इंग्रेस) ना</b> अ	lations, 2015. T a twww.cslfina Directors at th an Accounting By orc (Mar (Mar દોટીમ ડ હેઠળ આઇઆ ધિકત અધિકા:	The full format of ance.in. heir respective Standards. Sdr of the Board Sdr. Rohit Gupta naging Directory DIN: 00045077	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission of The details of a 13.07.2021 and The complete website of the e	02.08.2 he date 12:00 p.1 of docur assets a d E auct details e-auctio QUIDA	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and BMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on ti on service provider https://ncltauction.auctiontiger.net Sal. TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1115 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.com
1. The above is an extra Regulation 33 (and of the above Financial R           2. The above Un-audit meetings held on Au           3. The above Un-audit Place : Noida Date : 11.08.2021 <b>હ્ટાડા સ</b> છંડેશન અને રીકન્સ્ટ્રક્શન અગાઉ ઇન્ડિયા <b>ઇન્સેલાઇ</b> અગાઉ ઇન્ડિયા <b>ઇન્સેલાઇ</b> અગાઉ ઇન્ડિયા <b>ઇન્સેલાઇ</b> અગાઉ ઇન્ડિયા <b>ઇન્સેલાઇ</b>	ther Regulations as applicable results is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be to a stock and the south of the south	e) of the SEBI (Listing Ohligations and Rexchange websile - www beenda.o reviewed by the Audit Committee a een prepared in accordance with the <b>મહેટ નોદીસ (પરિં</b> (સ અને એન્ફ્રોર્સમેન્ટ ઓફ સિસ્મોર્ટ મીટેડ તરીકે જાણીતી) (આઇઆઇટ અંદ છે, જે છે અને જેમ છે ના ધરણે	Disclosure Requ omand on the con and approved by principles laid do QUE - & UEI ઇન્ટરેસ્ટ એ એફએલ એચએ પે નરીદી માટે સ	irements) Regumpany's websit mpany's websit y the Board of own in The Indi રઝે) (દિ કેટ, ૨૦૦૨ કેએલ) ના અ દીલબંધ કવરમ	lations, 2015. T a tww.csifina Directors at th an Accounting By or (Mar રાટીમ ૮ હેઠળ આઇઆ દિકૃત આઇઆ દિકૃત અધિકા i ઓફરો મંગા	The full format of ance.in. heir respective Standards. der of the Board Sdi- Rohit Gupta naging Director) DIN: 00045077 ( <b>ફ</b> ) ઇઇએફએલ. હો રીએ નીચે જણ વવામાં આવે છે	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 an The complete website of the e	02.08.2 he date 12:00 p. of docur assets a d E auct details e-auctio QUIDA nce Add	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on ti on service provider https://ncltauction.auctiontiger.net KARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1115 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.com Regd. Address: #206 Shivalik Enclav
1. The above is an extra Regulation 33 (and of the above Un-audit meetings held on Au. J. The above Un-audit Meetings held on Au. Date : 11.08.2021 <u>દ્રિટ્ટ્</u> () સા <u>દ્ર</u> () સા અને રી કન્સ્ટ્ર કશન આ લીધા અન્વયે , નીચે જ લ છે : - (સે)/ સહ-દેવાદાર(સે)/	ther Regulations as applicable results available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be <b>ICE CALLIEL of Q</b> ઓફ ફાયનાન્સિયલ એસેટ્ ન હાઈસિંગ ફાયનાન્સ લી: પ્રાવેલ સ્થાવર મિલકતોની <b>માંગણા નોટીસની</b>	e) of the SEBI (Listing Ohlgations and KExchange website – www.bseindia.o. reviewed by the Audit Committee a en prepared in accordance with the <b>MCC on Content of Content of Content</b> <b>MCC on Content</b> <b>MCC on Content</b> <b>MCC on Content</b> <b>MCC on Content</b>	Disclosure Requ omand on the con and approved by principles laid do QUE - & UEI ઇન્ટરેસ્ટ એ એફએલ એચએ પે નરીદી માટે સ	irements) Regumpany's websit mpany's websit y the Board of own in The Indi રઝે) (દિ કેટ, ૨૦૦૨ કેએલ) ના અ દીલબંધ કવરમ	lations, 2015. T a twww.cslfina Directors at th an Accounting By orc (Mar (Mar દોટીમ ડ હેઠળ આઇઆ ધિકત અધિકા:	The full format of ance.in. heir respective Standards. der of the Board Sdi- Rohit Gupta naging Director) DIN: 00045077 ( <b>ફ</b> ) ઇઇએફએલ. હો રીએ નીચે જણ વવામાં આવે છે	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 and The complete website of the e Li a. Corresponder	02.08.2 he date 12:00 p. of docur assets a d E auct details e-auctio QUIDA nce Add	of the E-auction are available on http://embeeip.com and on ti on service provider https://ncltauction.auctiontiger.net Sd/- HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBB/I/PA-002/IP-N00418/2017-18/1119 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.com Regd. Address: #206 Shivalik Enclaw NAC Manimajra, Chandigarh-16010
1. The above is an extr Regulation 33 (and of the above Financial meetings held on Au The above Un-audit meetings held on Au Jate : Noida Date : Noida Date : 11.08.2021 Comparison Cell & Au Cell & Au Solution of the second Solution of the second So	ther Regulations as applicable results is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be to a stock and the south of the south	e) of the SEBI (Listing Ohlgations and Rexchange websile - www beendaco reviewed by the Audit Committee a een prepared in accordance with the <b>M&amp;C ohlgath</b> ( <b>uRe</b> ) (સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિસ્મોર્ટ <b>મીટે</b> ડ તરીકે જાણીતી) (આછ્યાછ અંદ છે, છે છે અને જેમ છે ના ધોરણે ભોલિક કળજાની તરીષ્ઠ	Disclosure Requ omand approved by principles laid do <b>શિષ્ટ – ૪</b> દીરી ઇન્ટરેસ્ટ એ <b>એ કંએલ એચએ</b> <b>પે નરીદી માટે સ</b> સ્થાવઃ	irements) Regu npany's websil y the Board of swn in The Indi કરે, ૨૦૦૨ ફએલ) ના અ દીલબંધ કવરમ ર મિલક્ત / તિ	lations, 2015. T a divenvecsiffina Directors at th an Accounting By orc (Mar રાટીમ ૮ હેઠળ આદાઆ ચિકૃત અધિકા i ઓફરો મંગા સક્રચોર્ડ એસેટ્	he full format of ance.in. heir respective Standards. der of the Board Sd/ Rohit Gupta anging Director) DIN: 00045077 (દ) દાઇએફએલ હો રીએ નીચે જણ વવામાં આવે છે ર્સની વિગત	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 and The complete website of the e U at Corresponder U Date: 11.08.2 Place: Chance	02.08.2 he date 12:00 p. of docur assets a d E auct details e-auctio QUIDA nce Add	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 fro m. (With unlimited extension of 5 minutes each). Accordinglythe da ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on tl on service provider https://ncltauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1119 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.com Regd. Address: #206 Shivalik Enclavy
1. The above is an extr Regulation 33 (and of the above Financial meetings held on Au The above Un-audit meetings held on Au Jate : Noida Date : Noida Date : 11.08.2021 Comparison Cell & Au Cell & Au Solution of the second Solution of the second So	ther Regulations as applicable results available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be <b>ICE CALLIEL of Q</b> ઓફ ફાયનાન્સિયલ એસેટ્ ન હાઈસિંગ ફાયનાન્સ લી: પ્રાવેલ સ્થાવર મિલકતોની <b>માંગણા નોટીસની</b>	e) of the SEBI (Listing Ohligations and KExchange websile – www.bseinda.o. reviewed by the Audit Committee a earn prepared in accordance with the earn prepare	Disclosure Requ omand on the cou and approved by principles laid do <b>શિષ્ટ – ૪</b> તેરી ઇન્ટરેસ્ટ એ એ ક્લ્બેલ એચએ તે ખરીદી માટે સ સ્થાવઃ દ નં. ૨૦૬, ૨	irements) Reg. mpany's websit y the Board of wwn in The Indi ડોક્ટ, ૨૦૦૨ ફએલ) ના આ વિલ્બંધ કવરમ ર મિલક્ત / તિ મક્ષર એવ	lations, 2015. T eatwww.cslfina Directors at th By orc (Mar પાંચમ (Mar પાંચમ (પાંચમ હેઠળ આઇઆ ચિકૃત ગવિકા ાં ઓફરો મંગા મક્સોર્ડ એસેટ જ્યું , સુપ્રિમ	he full format of ince.in. heir respective Standards. der of the Board Rohit Gupta anging Directory Div: 00045077 (E) પછ્યે ફએલ હો રીએ નીચે જણ વવામાં આવે છે રૂસની વિગત હોટેલ પહેલ	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 and The complete website of the a Ll at Corresponder it Date: 11.08.2 Place: Chance	02.08.2 he date 12:00 p. of docur assets a d E auct details e-auctio QUIDA nce Add	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and BMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on t on service provider https://nottauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1115 fress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16000 Email: ip.suryapharma@gmail.co Regd. Address: #206 Shivalik Enclaw NAC Manimajra, Chandigarh-16010 Email: hkj_jatana@yahoo.co.in , Ph. No. 981458372
1. The above is an extra Regulation 33 (and of the above Un-audit meetings held on Au. J. The above Un-audit Meetings held on Au. Date : 11.08.2021 <u>દ્રિટ્ટ્</u> () સ <u>દ્ર</u> () સા ઇન્સ્ટ્ર કશન આ લીધા અન્વયે , નીચે જ લ છે : - (સે)/ સહ-દેવાદાર(સે)/	ther Regulations as applicable tesults is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be view of the stock of the stock of the stock of the stock of the stock of the stock of the stock of the stock guide at the stock of the stock of the stock of the stock of the stock	e) of the SEBI (Listing Ohligations and KExchange websile - www.bseindia.o. reviewed by the Audit Committee a ear prepared in accordance with the <b>જાહેટ નોટીસ (પરિં</b> (સ અને એન્સેર્સમેન્ટ ઓફ સિક્યો ર્ મીટેડ <b>ત રીકે જાણીતી) (આઇઆઇ</b> સ્થાં છે, જે છે અને જેમ છે ના ધોરણે <b>લોસિક કબજાની</b> <b>દારીખ</b> કરો-રેન્ટલ અએગસ્ટ, સ્ટલ અંગ ઝેસ્ટ લાલી	Disclosure Requ om and on the coi and approved by principles laid do <b>શિષ્ટ – ૪</b> દેશિ ઇન્ટરેસ્ટ એ એફએલ એચએ એફએલ એચએ રચાલઃ ર વં. ૨૦૬, ૨ ૬૨૧, ગુજરા	irements) Reg. mpany's websit y the Board of wwn in The Indi ડાક્ટ, ૨૦૦૨ ફએલ) ના આ વિલર્ધ કવરમ ર મિલકત / તિ મસર એવર ત ખાતેની	lations, 2015. T eatwww.cslfina Directors at th By orc (Mar પાંચા કરા હેઠળ આઇઆ ચિકૃત અધિકા ાં ઓફરો મંગા મક્સોર્ડ એસેટ્ ત્યું , સુપ્રિમ તમામ ફિ	he full format of incoein. heir respective Standards. Jer of the Board aging Directory Div: 00045077 (E) (S) (S) (S) (S) (S) (S) (S) (S) (S) (S	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 and The complete website of the or Ll Corresponder it Date: 11.08.2 Place: Chance 5,	02.08.2 he date 12:00 p. of docur assets a d E auct details e-auctio QUIDA nce Add	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordinglythe de ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on ti on service provider https://ncltauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBB/I/PA-002/IP-N00418/2017-18/1119 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.con Regd. Address: #206 Shivalik Enclaw NAC Manimajra, Chandigarh-16010 Email: hkj_jatana@yahoo.co.in , Ph. No. 981458372 METAL COATINGS (INDIA) LIMITED
1. The above is an extr Regulation 33 (and of the above Financial R 2. The above Un-audit meetings held on Au 3. The above Un-audit Place : Noida Date : 11.08.2021	ther Regulations as applicable results is available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be to the state of the sould be applied to the state of the sould be applied to the sould be applied by the sould be used as a state of the sould be applied to the sould be applied by the sould be applied to the sould be applied by the sould by the sould be applied by the sould be applied by the sould by the s	e) of the SEBI (Listing Ohligations and KExchange websile - www.bseindia.o. reviewed by the Audit Committee a ear prepared in accordance with the <b>જાહેટ નોટીસ (પરિં</b> (સ અને એન્સેર્સમેન્ટ ઓફ સિક્યો ર્ મીટેડ <b>ત રીકે જાણીતી) (આઇઆઇ</b> સ્થાં છે, જે છે અને જેમ છે ના ધોરણે <b>લોસિક કબજાની</b> <b>દારીખ</b> કરો-રેન્ટલ અએગસ્ટ, સ્ટલ અંગ ઝેસ્ટ લાલી	Disclosure Requ omand on the cou and approved by principles laid do <b>શિષ્ટ – ૪</b> તેરી ઇન્ટરેસ્ટ એ એ ક્લ્બેલ એચએ તે ખરીદી માટે સ સ્થાવઃ દ નં. ૨૦૬, ૨	irements) Reg. mpany's websit y the Board of wwn in The Indi ડાક્ટ, ૨૦૦૨ ફએલ) ના આ વિલર્ધ કવરમ ર મિલકત / તિ મસર એવર ત ખાતેની	lations, 2015. T eatwww.cslfina Directors at th By orc (Mar પાંચા કરા હેઠળ આઇઆ ચિકૃત અધિકા ાં ઓફરો મંગા મક્સોર્ડ એસેટ્ ત્યું , સુપ્રિમ તમામ ફિ	he full format of incoein. heir respective Standards. Jer of the Board aging Directory Div: 00045077 (E) (S) (S) (S) (S) (S) (S) (S) (S) (S) (S	mentioned as 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission The details of a 13.07.2021 and The complete website of the a Ll Corresponder Date: 11.08.2 Place: Chance S,	02.08.20 he date 22:00 p.l of docur assets a d E auct details e-auctio QUIDA nce Add 2021 digarh	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 fro m. (With unlimited extension of 5 minutes each). Accordinglythe da ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Document remains unchanged. of the E-auction are available on http://embeeip.com and on th service provider https://ncltauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1119 tress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.cou Regd. Address: #206 Shivalik Enclavv NAC Manimajra, Chandigarh-16010 Email: hkj_jatana@yahoo.co.in , Ph. No. 981458372' METAL COATINGS (INDIA) LIMITED CINL Z4899DL1994PLC063387
1. The above is an extr Regulation 33 (and of the above Financial meetings held on Au The above Un-audit meetings held on Au Jate : Noida Date : Noida Date : 11.08.2021 Comparison Cell & Au Cell & Au Solution of the second Solution of the second So	ther Regulations as applicable results available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be <b>I.G. QUELLE of QUELLE of QUELLE</b> . ઓફ ફાયનાન્સિયલ એસેટ્ ન હાઉસિંગ ફાયનાન્સ લી ણાવેલ સ્થાવર મિલકતોની 	e) of the SEBI (Listing Ohligations and Exchange websile – www.beerindia.o Revealed by the Audit Committee a een prepared in accordance with the <b>Mહેર નોટીસ (પશિ</b> સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યો ર્ <b>મોટેડ તરીકે જણીતી) (આઇગાઇ</b> જ્યાં છે, જે છે અને જેમ છે ના ધોરણે ભોલિક કાર્બ્યુબની ૨૩–મે–૨૦૧૬ ૧૦ ઓગસ્ટ,૨૦૦૧ ૧૦ ઓગસ્ટ,૨૦૦૧	Disclosure Requ om and on the coi and approved by principles laid do દી ઇ પ્-ટરેસ્ટ એ એફએલ એચએ એફએલ એચએ સ્ટાર્સ, ૨૦૬, ૨ દરા, ગુજરા મા. (બિલ્ટ સ	irements) Reg. mpany's websil y the Board of www.in The Indi અંગ (Co કરને લ) ના અ દ્વિલક્ત / તિ મક્ષર એવ્ય ત ખાતેની આપ એરિચ	lations, 2015. T aat www.csflina Directors at the an Accounting By or <b>121 H C</b> હેઠળ આઇઆ ચિફ્રન અધિકા ાં ઓફરો મંગા મક્સોર્ડ એસેટ્ ત્ર્યુ, સુપ્રિમ ત તમામ મિ I – ૪૦૦ ૨૨	he full format of incoein. her respective Standards. Ber of the Board anging Directory Div: 00045077 (E) (E) (E) (E) (E) (E) (E) (E) (E) (E)	mentioned as 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission The details of a 13.07.2021 and The complete website of the a Ll Corresponder Date: 11.08.2 Place: Chance S,	02.08.2 he date 12:00 p.1 of docur assets a d E auct details e-auctio QUIDA nce Add 2021 digarh	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and BMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on ti on service provider https://ncltauction.auctiontiger.net
1. The above is an extr Regulation 33 (and of the above Financial meetings held on Au 3. The above Un-audit meetings held on Au 9 2000 2000 2000 2000 2000 2000 2000 2	ther Regulations as applicable tesults is available on the Stock test is available on the Stock test is available on the Stock and the Stock and the Stock gust 11, 2021. ed Financial Results have be <b>ICE CALL TO 1</b> and the Stock and the Stock of the Stock and the Stock and Stock and the Stock and Stock and the Stock and Stock and the Stock and Stock and the Stock and the stock and the Stock and the Stock and Stock and the Stock and the stock and the Stock and the Stock and Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and the Stock and the Stock and the Stock and the stock and the Stock and th	e) of the SEBI (Listing Ohlgations and KExchange website – www.bseindia.o. reviewed by the Audit Committee a ene prepared in accordance with the <b>MCC2 ohlocks ( પાર્ટિંટ</b> (સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્સોર્ટ <b>મોટેડ તરીકે જાણીતી) (આઇઆઇ</b> ) જ્યાં છે, જે છે અને જેમ છે ના ધોરણે <b>ભોતિક કળજાની</b> તારીઆ ર ટ - મેન્ટ જાદ ધોરા છે, જે છે અને જેમ છે ના ધોરણે દ્વારા છે, જે છે અને જેમ છે ના ધોરણે લો છે લા હોય છે.	Disclosure Requ om and on the coi and approved by principles laid do <b>શિષ્ટ – ૪</b> દેશિ ઇન્ટરેસ્ટ એ એફએલ એચએ એફએલ એચએ રચાલઃ ર વં. ૨૦૬, ૨ ૬૨૧, ગુજરા	irements) Reg. mpany's websit y the Board of www.in The Indi ડે. કર, ૨૦૦૨ કરુવેલ) ના અ દિલબંધ કવરમ 2 બિલક્ત / તિ મક્સર એવ.) ના આ તેવી મક્સર ઓવ. (સા.)	lations, 2015. T aat www.csflina Directors at ut an Accounting By orc <b>1214 C</b> હેઠળ આઇઆ ચિકૃત અધિકા ાં ઓફરો મંગા સક્સ્ટાર્ડ એસ્ટ્રેફ ન્યુડી, સુડિમ ત તમામ મિ I – ૪૦૦ ચં અર્ગર	he full format of incoein. heir respective Standards. Jer of the Board aging Directory Div: 00045077 (E) (S) (S) (S) (S) (S) (S) (S) (S) (S) (S	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission or The details of a 13.07.2021 an The complete website of the of Ll Corresponder at Date: 11.08.2 Place: Chand	02.08.20 he date 22:00 p.1 of docur assets a d E auction details e-auction QUIDA nce Add 2021 digarh	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and EMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on t on service provider https://ncltauction.auctiontiger.net HARVINDER KUMAR JATAN TOR IN THE MATTER OF SURYA PHARMACEUTICAL LIMITE Regn. No.: IBBI/IPA-002/IP-N00418/2017-18/1115 dress: SCO 2935-36, First Floor, Sector-22C, Chandigarh-16002 Email: ip.suryapharma@gmail.co Regd. Address: #206 Shivalik Enclav NAC Manimajra, Chandigarh-16011 Email: hkj_jatana@yahoo.co.in , Ph. No. 981458372 METAL COATINGS (NDIA) LIMITED CIN: L74890L1994PLC063387 d Office: 912, Hemkunt Chamber.89, Nehru Place, New Delhi - 110019 Dinfogmeindina ent; Website: www.mcli.net, Tet: -91-114.1808125
1. The above is an extr Regulation 33 (and of the above Financial R 2. The above Un-audit meetings held on Au 3. The above Un-audit Place : Noida Date : 11.08.2021	ther Regulations as applicable results available on the Stock ted Financial Results were gust 11, 2021. ed Financial Results have be <b>I.G. QUELLE of QUELLE of QUELLE</b> . ઓફ ફાયનાન્સિયલ એસેટ્ ન હાઉસિંગ ફાયનાન્સ લી ણાવેલ સ્થાવર મિલકતોની 	e) of the SEBI (Listing Ohlgations and KExchange website – www.bseindia.o. reviewed by the Audit Committee a ene prepared in accordance with the <b>MCC2 ohlocks ( પાર્ટિંટ</b> (સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્સોર્ટ <b>મોટેડ તરીકે જાણીતી) (આઇઆઇ</b> ) જ્યાં છે, જે છે અને જેમ છે ના ધોરણે <b>ભોતિક કળજાની</b> તારીઆ ર ટ - મેન્ટ જાદ ધોરા છે, જે છે અને જેમ છે ના ધોરણે દ્વારા છે, જે છે અને જેમ છે ના ધોરણે લો છે લા હોય છે.	Disclosure Requ om and on the coi and approved by principles laid do ગે ક્લેસ્ટેસ્ટ એ એક્સ્સેસ એચએ પ પરીદી માટે સ સ્ટાવ સ્ટાર, ગુજરા મા. (બિલ્ટ સ્ રિપ્રવ કિંમત	iremenis) Reg. mpany swebsis y the Board of wm in The Indi (દકર, ૨૦૦૨ ફએલ) ના આ દિલબંધ કવરમ 2 ભિલક્ત / દિ મસર એવ- ત ખાતે ભી ખપ એરિસ (દા.) પેરા શાર લાપ	lations, 2015. T adtww.csflman Directors at the an Accounting By or <b>1224 C</b> હેઠળ આઇશ્વા ધિકૃત અધિકા ાં ઓફરો મંગા <b>મકાર્ચો ડં ઓફરો</b> નંગા <b>મકાર્ચે ડં ઓફરો</b> નંગા <b>મકાર્યે ડં ઓફરો</b> નંગા <b>મ</b> (તમામ મિ <b>પ</b> <b>પ્રાપ્ત પ્રાપ્ત</b> <b>પ્રાપ્ત પ્રાપ્ત</b>	he full format of ince in. ince in. her respective Standards. Ber of the Board aging Director) Dirk: 00045077 ( <b>દ</b> ) કાર એકએલ હો રાચ્ચે ક્લ્મેલ હો રાચ્ચે ક્લ્મેલ હો રાચ્ચે ક્લ્મેલ હો રાચ્ચે ક્લ્મેલ હો રાચ્ચે ક્લમેલ ક્લમેલ હો રાચ્ચે ક્લમેલ ક્લમેલ હો રાચ્ચે ક્લમેલ હો રાચ્ચે ક્લમેલ કલ્ય રાચ્યે ક્લમેલ ક્લમેલ ક્લમેલ ક્લમેલ ક્લમેલ ક્લમેલ કલ્ય રાચ્યે ક્લમેલ કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્ય રાચ્યે ક્લમેલ કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્ય કલ્	mentioned as ( 31.07.2021. Ti 11.00 a.m. to 0 of submission The details of a 13.07.2021 and The complete website of the e uebsite of the e Ll Corresponder Date: 11.08.2 Place: Chance S, D	02.08.2 he date 12:00 p.1 of docur assets a d E auct details e-auctio QUIDA nce Add 2021 digarh	e of e-auction is now rescheduled on Tuesday, 31.08.2021 from m. (With unlimited extension of 5 minutes each). Accordingly the de ments and BMD which was 10.08.2021 is extended upto 30.08.202 and all other terms and conditions as mentioned in sale notice dat tion Process Information Documentremains unchanged. of the E-auction are available on http://embeeip.com and on t ns service provider https://ncltauction.auctiontiger.net

financial year 2020-21, will be sent only by electronic mode to all the members of the Company whose email address are egistered with the Company/Depository Participant(s). The aforesaid documents will also be available on the Company's rebistie at www.mcil.net, Stock Exchange's website at <u>www.besindia.com</u> and on the website of Company's Registrars and ransfer Agnets, Link htime hidle Private Limited ("LIIP") at <u>https://witastwote.inkinime.co.in</u> fembers holding shares in physical mode and who have not updated their email addresses, are requested to update their

nail addresses by writing to the Company at cs@mcilindia.net along with the copy of the signed request letter mentionin is/her folio number along-with self attested copy of the PAN card and any one document i.e. Driving License, Election dentity Card, Passport or AADHAAR Card. Members holding shares in dematerialised mode, who have not registered odated their email addresses, are requested to register/ update their email addresses with the Depository Participants wi hom they maintain their demat accounts. mbers can cast their vote(s) on the business as set out in the notice of the AGM through electronic means ("e-Voting"

The Company has engaged LIPL to provide to the members, the facility of remote e-Voting and the facility of joining attending AGN through VCOAWA and e-Voting at the AGN. The process and manner of remote e-Voting, Joining attending the AGN through VCOAWA and e-Voting at AGN, for members holding shares in demat form or physical form and for members who have not registered their email address, has been provided in the Notice of AGM. The members attending the AGM through VC/OAVM, who have not cast their vote through remote e-Voting, shall be allowed to vote through Voting at the AGM NOTICE OF BOOK CLOSURE

IOTICE OF BOOK CLUSUNE. Notice is hereby given that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed fror rinday, 10<sup>th</sup> September, 2021 to Thursday, 16<sup>th</sup> September, 2021 (both days inclusive) for the purpose of AGM. For Metal Coatings (India) Limite

Ayati Gupt Company Secretary & Compliance Office

ed: 11th August, 2021

## 🗿 એઆઈએ એન્જિનિચરીંગ લીમીટેડ

કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નં. : એલ૨૯૨૫૯જીજે૧૯૯૧પીએલસી૦૧૫૧૮૨ **રજીસ્ટર્ડ ઓફીસ** : ૧૧૫, જી. વી. એમ. એમ. એસ્ટેટ, ઓટવ રોડ, ઓટવ, અમદાવાદ–૩૮૨ ૪૧૦ વેબસાઇટ : www.aiaengineering.com ઇમેઇલ : ric@aiaengineering.com ફોન : ૦૭૯-૨૨૯૦૧૦૭૮, ફે<del>ક્સ</del> : ૦૭૯-૨૨૯૦૧૦૭૭

### ૩૧મી વાર્ષિક સામાન્ચ સભા, ઈ–વોટીંગ માહિતી તથા બુક બંધ અંગેની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે, મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સના, પરિપત્ર નં.૧૪/૨૦૨૦ તા.૮મી એપ્રિલ,૨૦૨૦, પરિપત્ર નં.૧૭/૨૦૨૦ તા.૧૩મી એપ્રિલ ૨૦૨૦, પરિપત્ર નં.૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦ અને પરિપત્ર નં. ૦૨/૨૦૨૧ તા.૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ તથા સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પરિપત્ર નંબર SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦ અને પરિપત્ર નં. SEBI/HO/CFD/ CMD2/CIR/P/2021/11 ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ને ધ્યાનમાં રાખતા. કંપનીની ૩૧મી વાર્ષિક સામાન્ય સભા શક્રવાર. તારીખ ૩ સપ્ટેમ્બર. ૨૦૨૧ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સ (''વીસી ")/અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (''ઓએવીએમ '')દ્વારા યોજાશે, જેમાં ૩૧મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવ્યા મુજબ સામાન્ય તથા ખાસ બિઝનેસ કરવા માટે યોજાશે.

વાર્ષિક સામાન્ય સભાની નોટીસ, વાર્ષિક અહેવાલ સાથે કે જેમાં ઈ-વોટીંગ અંગેની સૂચનાઓ પણ છે તે, દરેક સભાષદને કે જેના ઇમેઇલ આઈડી કંપની અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સાથે નોંધાયેલા હોય તેઓને ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફત મોકલવામાં આવેલ છે. સભ્યોએ નોંધ લેવી કે વાર્ષિક સામાન્ય સભાની નોટીસ તથા વર્ષ ૨૦૨૦-૨૧ નો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.aiaengineering.com</u>, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ, બીએસઈ લીમીટેડ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.nseindia.com તથા ઈ-વોટીંગની સુવિધા પુરી પાડનાર સંસ્થા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (''ઇન્ડિયા") લીમીટેડની વેબસાઈટ www.evotingindia.com પરથી ડાઉનલોડ કરી શકાશે.

### રિમોટ ઈ-વોટીંગ અને વાર્ષિક સામાન્ય સભા દરમ્યાન ઈ-વોટીંગ ઃ

કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૦૮ની સાથે સુધારા <mark>સહિતના</mark> કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ) રૂલ્સ, ૨૦૧૪ (''નિયમ'')ના નિયમ ૨૦ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ ન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યલેશન. ૨૦૧૫ ના રેગ્યલેશન ૪૪ મજબ કંપની તેન સભાષદો ને વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવ્યા બિઝનેસ માટે સી.ડી.એસ.એલ.ની રીમોટ ઈ-વોટીંગની સુવિધા આપે છે. રીમોટ ઈ-વોટીંગ અને વાર્ષિક સામાન્ય સભા દરમ્યાન ઈ-વોટીંગ અંગેની વિગતવાર સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં આપેલ છે જે સભાષદોને મોકલી આપવામાં આવેલ છે. કંપની ધારા, ૨૦૧૩ અને તેના નિયમ મુજબ નીચે મુજબ વિગતો આપવામાં આવે છે ૧. ઈ-વોટીંગ માટે કટ ઑફ તારીખ : શુક્રવાર, ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧.

Sr. No.	Particulars	Quarter Ended 30/06/2021	Quarter Ended 30/06/2020	Year Ended 31/03/2021		
10.		(Unaudited)	(Unaudited)	(Audited)		
1	Total Income from operations	430.03	374.65	1,458.75		
2	Net Profit / (Loss) for the period (before tax and exceptional items)	(68.30)	(80.76)	(352.90)		
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional items)	(68.30)	(80.76)	(352.90)		
4	Net Profit / (Loss) for the period after tax	(47.79)	(47.25)	(235.68)		
5	Total Comprehensive income for the period [Comprising Profit /	(46.82)	(41.53)	(161.17)		
	(Loss) for the period (after tax) and other Comprehensive					
-	Income (after tax)]		4 000 00			
6	Equity Share Capital (of Rs. 5/- each)	1,883.38	1,883.38	1,884.38		
7	Earning Per Share (not annualised)	(0.13)	(0.13)	(0.46)		
	Basic :		· · · ·	( )		
	Diluted :	(0.13)	(0.13)	(0.46)		
Note : The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulations 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on www.nseindia.com, www.bseindia.com and on the Company website www.bfutilities.com. For BF Utilities Limited B S Mitkari Director Date : 11 August, 2021 DIN : 03632549						

**રીજનલ ઓફીસ** : ૮૨–એ, ન્યુચોર્ક ટાવર બિલ્ડીંગ, ચલતેજ ક્રોસ રોડ, ચલતેજ, અમદાવાદ–૩૮૦૦૫૪ **શાખા ઓફીસ** : ૨૦૧–૨૦૩, શિવ પોઇન્ટ, બીજો માળ, દેસાઇ પાર્ક સોસાચટી, કોલેજ રોડ, નડિયાદ–૩૮૭૦૦૧

**BF UTILITIES LIMITED** 

Read, Off.: Mundhwa, Pune Cantonment, Pune-411036

સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (૧) હેઠળ (સ્થાવર મિલકત માટે) આથી મેસર્સ મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ(અહીં પછી એમઆરએચએફએલ),જે તેની રજીસ્ટર્ડ ઓફીસ **અમદાવાદ** ખાતે અને શાખા ઓફીસ **નડિયાદ** ખાતે ધરાવે છે તેના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટં ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪) હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી જણાવેલ એક્ટ કલમ ૧૩ (૧૨) હેઠળ મળતી સત્તાની રૂએ કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ જારી કરી તમો દેવાદાર (નામ અને સરનામું નીરં જણાવેલ છે) ને જણાવેલ નોટીસમાં દર્શાવેલ ૨કમ જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યુ હતું.

અહીં જણાવેલ દેવાદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી અહીં જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ)નિયમો. ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને કબજો ૭ ના રોજ લઇ લીધો છે.

ખાસ કરીને અહી જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને આથી જણાવેલ મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો મેસર્સ મહિન્દ્રા રૂરલ હાઉસિંગ લીમીટેડની ૨કમ અને તેના પરના વ્યાજને આધિન રહેશે.

સિક્યોર્ડ એસેટ્સ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય મર્યાદાના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

ક્રમ નં.	દેવાદાર(૨ો)/ જામીનદાર(૨ો) નું નામ	સિક્યોર્ડ એસેટ (સ્થાવર મિલકત) ની વિગત	માંગણા નોટીસની તારીખ અને રકમ	કબજાની તારીખ
	(લોન નં. 194614/XRESNAD00159630/ નડિચાદ શાખા) ભલાભાઇ ભરતભાઇ પરમાર (દેવાદાર) દિવાળીબેન ભલાભાઇ પરમાર (સહ-દેવાદાર) રાજેન્દ્રકુમાર ભલાભાઇ પરમાર (સહ-દેવાદાર) ડાહ્યાભાઇ ભલાભાઇ પરમાર (સહ-દેવાદાર) વિક્રમસિંહ લક્ષ્મણસિંહ ઠાકોર (જામીનદાર)	હાઉસ નં. ૯, મુકામ–પોસ્ટ, ઉબા, તાલુકો–ઠાસરા, જિદ્યો–ખેડા, ગુજરાત–૩૮૭૪૧૧, ઉત્તર : ગણપતભાઇનું ઘર, દક્ષિણ : ખુલી જમીન, પુર્વ : રોડ, પશ્ચિમ : વાડો	૩૧–૦૭–૨૦૧૭ રૂા.	૦૬–૦૮–૨૦૨૧ ભૌતિક કબજો
સ્થા	u : ગજરાત તારીખ : ૧૨.૦૮.૨૦૨૧ સઢી/–	અદ્યિકત અદ્યિકારી મહિન્દા ૩	રલ હાઉસિંગ કાચન	ાન્સ લીમીટેડ

#### **Bilcare Limited** Bilcare

Regd. Office : 1028, Shiroli, Pune 410505.Tel : +91 2135 647300 Fax : +91 2135 224068 Research Email: investor@bilcare.com Website: www.bilcare.com CIN : L28939PN1987PLC043953

uncial Results (Unaudited) for the Quarter Ended June 30, 202

Sr.		Quarter Ended	Quarter Ended	Quarter Ended	Year Ended
<b>١</b> ٥.	Particulars	30 June 2021	31 March 2021	30 June 2020	31 March 2021
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1. 2.	Total Income from Operations Net Profit / (Loss) for the period	181.69	186.52	140.37	641.11
3.	(before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(12.85) (12.85)	(11.42) 15.38	(16.16) (16.16)	(51.76) (24.96)
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(12.89)	15.31	(15.21)	(11.17)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income]	(12.31)	15.59	(15.07)	(11.97)
<b>3</b> .	Equity Share Capital	23.55	23.55	23.55	23.55
7.	Earnings Per Share (before and after extraordinary items) (of ₹ 10/- each)				
	a. Basic	(6.49)	4.97	(6.94)	(8.95)
	b. Diluted	(6.49)	4.97	(6.94)	(8.95)
(ey	Standalone Financial Information				(₹ in Cro
Sr.		Quarter Ended	Quarter Ended	Quarter Ended	Year Ended
lo.	Particulars	30 June 2021	31 March 2021	30 June 2020	31 March 2021
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
١.	Total Income from Operations	87.44	90.03	73.82	318.
2.	Profit / (Loss) Before Tax	(20.19)	33.92	(17.32)	(17.6
3.	Profit/(Loss)AfterTax	(18.62)	35.57	(15.76)	1.7

under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarte Ended Unaudited Financial Results are available on the Stock Exchange website - www.bseindia.com and on the Company' website -www.bilcare.com.

Previous periods' figures have been re-grouped / re-classified wherever necessary

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their

દ્ર્યડત વ્યાજ નોટીસમાં જણાવેલ બાકી રકમ પર લોન એગ્રીમેન્ટ મુજબ લાગુ રહેશે અને આકસ્મિક ખર્ચ, કોસ્ટ વગેરે બાકી છે અને તેના છુટકારા સુધી ચુકવવાપાત્ર છે, જેમાંથી કાનુની અને કોઇપણ ચાર્જને આધિન્ ...... પ. આથી દેવાદાર અને જામીનદારને વેચાણના સમયે હાજર રહેવા નોટીસ આપવામાં આવે છે અને તેઓ વેચાણની શરતો અને નિયમોની વિગતો મુજબ ઉપર જણાવેલ સ્થાવર મિલકતની ખરીદી માટે રસ ઘરાવ 

સહી/– અધિકૃત અધિકારી, આઇઆઇએફએલ હોમ ફાચનાન્સ લીમીટેડ (આઇઆઇએફએલ એચએફએલ) વર્ત નારીખ : ૧૨–૦૮–૨૦૨૧ સ્થળ : વડોદરા

## ક્રિસેન્ટ ફિનસ્ટોક લીમીટેડ

CIN : L55200GJ1997PLC032464 **૨જીસ્ટર્ડ ઓફીસ** : એ/૧૨, સ્નેહ કુંજ કો.હા.સો., રેસિડેન્સીચલ પ્લોટ નં. ૩૭૪, કોપરલી રોડ, જીઆઇડીસી, વાપી, -૩૯૬૧૯૫, ગુજરાત ફોન : ૦૨૨-૬૧૮૮ ૭૬૦૦, વેબસાઇટ : www.crescentfinstock.com

૩૦.૦૬.૨૦૨૧ ના રોજપુરા થતાં ત્રિમાસિક ગાળાના અન ઓડિટેડ નાણાંકિય પરિણામોનો સાર

						રૂા. લાખમાં
		અલાચદાં			સંચુક્ત	
	ગ્રિમાસિક	ત્રિમાસિક	વર્ષનાં	વર્ષનાં	ગ્રિમાસિક	વર્ષનાં
વિગતો	ગાળાનાં અંતે	ગાળાનાં અંતે	અંતે	અંતે	ગાળાનાં અંતે	અંતે
	30.05.2029	30.05.2050	39.03.2029	30.05.2029	30.05.2020	39.03.2029
	અનઓડિટેડ	અનઓડિટેડ	ઓડિટેડ	અનઓડિટેડ	અનઓડિટેડ	ઓડિટેડ
કામકાજમાંથી કુલ આવક (ચોખ્ખી)	४०.৫૩	0.83	૨.૭૭	४००.५०	૨૯૦.૦૦	૧૭૦૧.૫૫
ગાળાનો ચોખ્ખો નફો/તોટો (વેરા, અપવાદરૂપ	३९.४७	(૪.૯૦)	(૩૫.૧૪)	૧૦૨.૩૯	૧૪૫.૯૭	૨૩૧.૧૯
અને અસાધારણ ચીજો પહેલા)						
ગાળાનો ચોખ્ખો નક્ષે તોટો (વેરા પુર્વે,						
અપવાદરૂપ અને અસાધારણ ચીજો પછી)	૩૬.૪૯	(૪.૯૦)	(૩૫.૧૪)	૧૦૨.૩૯	૧૪૫.૯૭	૨૩૧.૧૯
ગાળાનો ચોખ્ખો નફો/તોટો						
(વેરા પછી, અપવાદરૂપ ચીજો અને						
અસાધારણ ચીજો પછી)	૧૧.૧૨	૧.૬૩	(૨૨.૫૨)	૪૨૮.૫૦	૧૫૨.૫૦	૮૧૬.૫૪
ઇક્વિટી શેર મુડી	૭૨૨.૩૫	૭૨૨.૩૫	૭૨૨.૩૫	૭૨૨.૩૬	૭૨૨.૩૬	૭૨૨.૩૬
(ગાળાના નફો / (તોટો) (વેરા પછી)						
અનામતો (પુર્ન મુલ્યાંકિત અનામતો સિવાયની,						
પાછલા વર્ષના સરવૈયામાં દર્શાવ્યા મુજબ)			૨૩૨૭.૫૨			૩૬૯૧.૭૪
શેરદીઠ કમાણી (પ્રતિદિઠ રૂા. ૧૦ ની)						
(વાર્ષિક નહી)						
(એ) મુળ	૦.૫૧	(0.09)	(०.४७)	૧.૪૨	૨.૦૨	૨.૯૭
(બી) ઘટાડેલી	૦.૫૧	(0.09)	(0.४৫)	૧.૪૨	૨.૦૨	૨.૯૭
<b>નોંધઃ ૧.</b> ૩૦.૦૬.૨૦૨૧ ના રોજ પુરા થતાં ત્રિમ	ાસકિ ગાળાના કંપનીના ર	બનઓડિટેડ નાણાંકિય પ	રિણામોની ઓડીટ કમી	ટી દ્વારા સમાલોચના ક	રવામાં આવી હતી અને બ	ોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા
૧૧.૦૮.૨૦૨૧ ના રોજ યોજાયેલ તેમની બેઠકમાં						
રીક્વાયરમેન્ટ્સ)નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩						
સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ (www.msei.in) ર	ત્રને કંપનીની વેબસાઇટ (\	www.crescentfin	stock.com) પરા	ષણ ઉપલબ્ધ છે.		ારેક્ટર્સના આદેશથી
						ાસ્ટોક લીમીટેડ વતી
સ્થળ : મુંબઇ					સહી/–	ચંદ્રમોહન જખમોલા
તારીખ : ૧૧.૦૮.૨૦૨૧						(સંપુર્ણ ડાયરેક્ટર)

AMJ

>/

AMJ LAND HOLDINGS LIMITED CIN: L21012MH1964PLC013058

Registered Office : Thergaon, Pune - 411 033. Tel.: 020-30613333 Fax: 020-30613388 E-mail: admin@amiland.com Website: www.amiland.com

	respective meetings held on August 11, 2021.	
		For Bilcare Limited
F	Place : Pune	Mohan H. Bhandari
1	Date :August 11, 2021	Managing Director

### 🗗 HDB 👯 મેચડીબી ફાચનાન્સિચલ સર્વિસીઝ લીમીટેડ

<mark>શાખા ઓફીસ</mark> : એચડીબી ફાચનાન્સિચલ સર્વિસિઝ લીમીટેડ, ૪૦૪, લેન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હોલ સામે, ટિટેનિચમ સિટી સેન્ટર

મોલ પાસે, આનંદનગર રોડ, સેટેલાઇ, અમદાવાદ–૩૮૦૦૧૫

**શાખા ઓફીસ** : એચડીબી ફાચનાન્સિયલ સર્વિસિઝ લીમીટેડ, પહેલો માળ, ઓફીસ નં. ૩૧૯ હિરા પજ્ઞા કોમ્પલેસ, ડૉ. ચાફીક રોડ રાજકોટ-૩૬૦૦૦૧

### કબજા નોટીસ

આથી એચડીબી ફાચનાન્સિયલ સવિંસીઝ લીમીટેડના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેલ અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪) હેઠળ અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમોના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩ (૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે બણાવેલ દેવાદાર/રોને માંગણા નોટીસ બારી કરી બણાવેલ નોટીસમાં દર્શાવેલ રકમ ચુકવણીની અસલ તારીખ સુધી તમામ કોસ્ટ, ચાર્જ અને

પ્રાપ્ત તપાણે પ્રયાગ કરીના ગાય ગણાપાર દપાદારો દાવ માગણા ગાય તે કાર પશાપાય માટાસના દયાપાય કરત ચુકપલામાં અસલ લાદળ અર્ચ સહીત બણાવેલ નોટીસ મળ્યાની તારીબાથી 60 દિવસની એંદર ચુકવવા ભણાવે હતું. બણાવેલ દેવાદારો/સહ દેવાદારો દસમની પરત ચુકવણી કરવામાં ભિષ્કળગયા લેલાથી દેવાદારો/સહ-દેવાદારો અને જાહેર જનાનો જાણ કરવામાં આવે છે કે નોચે સહી કરનારે બણાવેલ બિયમોના નિયમ ૮ સાથે વંચાલી બણાવેલ એક્ટની કલમ ૧૩ (૪) દેઠળ પ્રાપ્ત સલાનો ઉપયોગ કરીને નોચે બણાવેલ મિલકતાનો **સાંદે તિક કબજો** નીચે જણાવેલ તારીખોએ હાઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો અને જાહેર જનાનો આથી મિલકત સાથે કોઇ સોટો ન કરવા સાવધ કરવા પાયે છે અને મિલકતાનો **સાંદે તિક કબજો** નીચે જણાવેલ તારીખોએ ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડની બણાવેલ સ્કૂમ અને સંબંધિત તારીખથી ચડત વ્યાજ, કોસ્ટ અને આદીન રહેશે.

વાદાર અને સહ-દેવાદારની વિગત, શીડ્યુલ્ડ મિલકત, લોન એકાઉન્ટ નંબર, યુઆઇસી નં., બાકી રકમ, માંગણા નોટીસ અને કબજાની તારીખની માહિતી નીચે આપેલ છે

### ક્રમ ૧. નામ અને દેવાદાર, સહ–દેવાદારો/જામીનદારોનું નામ અને સરનામું, ૨. લોન એકાઉન્ટ નંબર, ૩, મંજુર કરેલ લોનની રકમ,

### ડ . સિક્ચોરીટીઝની વિગતો ૫. માંગણા નોટીસની તારીખ, ૬. દાવાની રકમ રૂા. માં, ૭. કબજાની તારીખ

પુત્તિ એન્ટરપ્રાઇઝ (અરજદાર/દેવાદાર) અને ભુમિકાબેન વિષ્ણુભાઇ પટેલ, મનિષકુમાર ભાઇજીભાઇ પટેલ (સહ–અરજદાર/સહ–દેવાદાર) તમામનું સરનામું: (એ) શોપ ૭ કૃષ્ણકુંજ પાર્ક, ગોકુલધામ સામે, વાડા રોડ, કઠવાડા રોડ, નવા નરોડા અમદાવાદ–૩૮૦૦૦૧. (બી) બી–૧૭, રાધે બંગ્લોઝ, અંબાલાલ પાર્ક સામે, ગિરદાર પાર્કની બાબુમાં, નિકોલ રોડ, નરોડા, અમદાવાદ–૩૮૦૦૦૧. (**ર) હોન એકાઉન્ટ નંબર** : 433૬૨૦૬ (**3) લોન નેકા રા. માં** : ગ્ર. ૩૫૪૬૦૪૩/– (રૂપિયા પાંગીસ લાખ છેતાલીસ ૯૧૧ રેતાલીસ પુરા) (**૪) સિક્ચોરીટીની વિગત** : ટેનામેન્ટ નં. બી/૧૭, રાધે બંગલોઝ, સર્વે નં. દ્દબોટ પેડી, ક્ષેત્રકળ ૧૦૯.૧૩ શો.મી. અને તેના પરનું બાંધકામ, મોજે– નરોડા, લાલુકો– અસારવા, બિલી અને પેટા જિવો– અમદાવાદ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા.(પ) માંગણા **નોટીસની તારીખ** : ૨૩/૦૩/૨૦૨૧ (**૬) બાકી રકમ રા. માં** : ગ્ર. ૪૮,૫૧,૬૨૫.૩૫/– (રૂપિયા પડતાલીસ લાખ ઝેકાવન હજાર છસો પરચીસ અને પાંગીસ પૈસા પુરા) ૨૩/૦૩/૨૦૨૧ મુજબ અને વાસ્તવિક છુટકારા સુધી કરારના દર્સ રાડત વ્યાજ તેમજઆકારિમક ખર્ચ, કોસ્ટ અને સાર્જ વગેરે. (**૭) કબજાની તારીખ** : ૦૬.૦૮.૨૦૨૧

ગયા તે કાર્ય પ્રયુપ્ય મુખ્ય મુખ્ય મુખ્ય પ્રગળ છે. આ મુખ્ય મ દરે ચડત વ્યાજ તેમજ આકસ્મિક ખર્ચ, કોસ્ટ અને ચાર્જ વગેરે. (**૭) કબજાની તારીખ** : ૦૬.૦૮.૨૦૨૧

3 ડી.એચપંચાલ મેન્યુ કેક્ચરીંગ કંપની (અરબ્દાટ/દેવાદાર)અને જિજ્ઞેશ અમરતલાલ પંચાલ , રેણુકાબેન જિજ્ઞેશ પંચાલ ,દિપકકુમાર એ પંચાલ , મંજુલાબેન એ પંચાલ (સહ–અરેજદાર/સહ–દેવાદાર) તમામનું સરબામું: (એ) પ્રતિક શોપ નં. ૫, પુષ્પાંજલી, નારણપુરા, અમદાવાદ ૨૦૦૦૧ (બી) ૧, બીજો માળ, પુષ્પાંજલી, નારણપુરા, નવરંગ હાઇસ્કુલ, અમદાવાદ– ૩૮૦૦૦૧. (સી) ૬૭, અનમોલ બંગલોઝ, અશોધ્યાનગરી સામે, જીએસટી રોડ પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ, ૩૮૦૦૦૧. (**૨) લોન એકાઉન્ટ નંબર** : ૧૩૪૭૫૪૦ (**૩) લોનની રકમ રૂા. માં** : રૂા. ૪૬૫૦૦૦૦/- (રૂપિસા છેલાલીસ લાખ પચાસ હજાર પુરા (૪) **સિક્ચોરીટીની વિગત** : ક્લેટ નં. ૪. ક્ષેત્રફળ ૯૯.૪૯ ચો.મી. (એએમસી ટેક્સ બિલ મુજબ), બીજો માળ, પુપ્પાંજલી કોમ્પલેસ, પ્રતિક શોપ્સ અને ઓફીસ ઓનર્સ એસોસિચેશન્સ, સબ પ્લોટ નં. ૧, સર્વે નં. ૪૪/૨, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૧૯, ફાઇનલ પ્લોટનું. ૬૧, મોજે -ઉષ્માનપુરા, તાલુકો-સાબેરમતી, જિલો અને પેટા જિલો– અમદાવાદ ખાતેની મિલક્તના તમામ ભાગ અને હિસ્સા. **(૫) માંગણા નોટીસની તારીખ** : ૨૩/૦૩/૨૦૨૧ **(૬) બાકી ૨કમ રૂા. માં** : રૂા. ૪૯,૫૮,૫૩૭.૮૩/– (રૂપિયા ઓગણપચાસ લાખ અઠાવન હજાર પાંચસો સાડગ્રીસ અને ત્યાંસી પૈસા પુરા) ૨૩/૦૩/૨૦૨૧ મુજબ અને વાસ્તવિક છુટકારા સુધી કરારના દરે ચડત વ્યાજ તેમજ આકસ્મિક ખર્ચ, કોસ્ટ અને ચાર્જ વગેરે. (**૭) કબજાની તારીખ** : ૦૬.૦૮.૨૦૨૧

ક્રિષ્ના મોટર રીવાઇડીંગ વર્ક (અરજદાર/દેવાદાર) અને અનિલ રવજી તોપીયા, રવજીભાઇ લિંબાભાઇ તોપીયા, રસિલાબેન કિશોરભાઇ તોપીયા (સહ અસ્જદાર/સહ-દેવાદાર) તમામનું સરનાયું: (એ) મુસાફીર બંગલોઝ પાછળ, ધોરાજી-૩૬૦૪૧૦ (બી) મુસાફીર બિલ્ડીંગ રોડ, કિષ્ના મોટર રીવાંઇડીંગ પાસે, ધોરાજી-૩૬૦૪૧૦. **(૨) લોન એકાઉન્ટ નંબર** : ૧૬૬૪૬૪૩ **(૩) લોનની રકમ રૂા**. માં : રૂા. ૨૮૦૦૦૦૦/– (રૂપિયા અઠયાવીસ લાખ પુરા) **(૪) સિક્યોરીટીની વિગત** : દોરાજા ટાઉનના માતાવાડી એરિયા ખાતે. પ્લોટ નં. ૫. એન.એ. સર્વે નં. ૪ અને ક્ષેત્રકળ ૨૨૨.૭૮૯ ચો.મી.. ધોરાજ ન્સિપાલીટીની હદમાં, રજીરદ્રેશન ડિસ્ટ્રીક્ટ રાજકોટ ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **(૫) માંગણા નોટીસની તારીખ** : ૨૩/૦૩/૨૦૨૧ **(૬) બાકી રકમ રૂા. માં** : રૂા. ૨૫,૫૮,૮૬૦.૯૦/– (રૂપિયા પર્સ્થીસ લાખ અહાવન હજાર આઠસો સાંઇઠ અને નેવું પૈસા પુરા) ૨૩/૦૩/૨૦૨૧ મુજબ અને ાસ્તવિક છુટકારા સુધી કરારના દરે ચડત વ્યાજ તેમજ આકસ્મિક ખર્ચ, કોસ્ટ અને ચાર્જ વગેરે. (**૭) કબજાની તારીખ** : ૧૦.૦૮.૨૦૨૧

પ્રતાપ એન્ટરપ્રાઇઝ (અરજદાર/દેવાદાર) અને બાલુભાઇ કોહરીમલ તલરેજા, કંચનબેન પ્રતાપભાઇ તલરેજા, પ્રતાપભાઇ બાલુભાઇ તલરેજા (સહ-પ્રતાપ એન્ટરપ્રાઇઝ (અરુજદાર/દેવાદાર) અને બાલુભાઇ કીન્દરીમલ તલરેજા, કેચનબેન પ્રતાપભાઇ તલરેજા, પ્રતાપભાઇ બાલુભાઇ તલરેજા (સહ– અરુજદાર/સહ–દેવાદાર) તમામનું સરનામું: (એ) કજાન મુળાગુસ્ટુટ, કુલવાડી સ્ટેશન રોડ, જેતપુર, રફડગ્ર૦. (બી) નવસેતન સ્કુલ સામે, પટેલ નગર– ૦૨, જુનો પાસીપળા રોડ, હનુમાન મંદિર, જેતપુર–૩૬૦૩૦૦. (ર) **લોન એકાઉન્ટ** નંબર : જારદ્વરૂપ (3) લો**નની સ્દમ** રૂા. માં : રૂા. 330000/– (સ્પિયા તેતરીસ લાખ પુરા) (૪) **સિક્ચોરીટીની વિગત** : સીટી સર્વે સીટ નં. ૨૭, સીટી સર્વે નં. ૧૬૦ ર પૈકી, ક્ષેત્ર મૂળ દુદ્વ. ટડ. થો.મી અને સીટી સર્વે નં. ૧૬૧૦ પૈકી ક્ષેત્ર કળ ૧૦.૮૯ ચો.મીની કુલ જ્મીન ક્ષેત્ર કળ ૮૦.૪૭ ચો.મી.ની રેસીકેન્સીચલ મિલકત, મોજે તેવપુર, પ્રિશ, ને સ્વરુ છ પડે સી અને સીટી સર્વે નં. ૧૬૧૦ પૈકી સેઝકળ ૧૦.૮૯ ચો.મી અને સીટી સર્વે નં. ૧૬૦ ર પૈકી સેઝકળ ૧૦.૮૯ ચો.મીની સુલ અને હિસ્સા અને સીટી સર્વે સીટ નં. ૨૦, સીટી સર્વે નં. ૧૬૦ ર પૈકી, સેઝકળ ૧૯ ૩૮ ચો.મી અને સીટી સર્વે નં. ૧૬૧૦ પૈકી સેઝકળ ૧૦.૮૯ ચો.મી ના સ્કુબ ટ્રા સ્ટે અટ બાને સિલકત ના તમામ ભાગ અને હિસ્સા અને સીટી સર્વે સીટ નં. ૨૦, સીટી સર્વે નં. ૧૬૦ ર પૈકી, સેઝકળ ૧૯ ૩૮ ચો.મી અને સીટી સર્વે નં. ૧૬૧૦ પૈકી સેઝકળ ૧૦.૮૯ ચો.મીની કુલ બનીન સેઝકળ ૬.૪૪ ચો.મી.ની કોર્મસીચલ મિલકત, મોજે તેવપુર, જિયો – રાજકોટ ખાતેની મિલકતન (૫) **મંગણા નોટીસની નારીખ**: ૨૩/૦૩/૨૦૪૧ (**૬) બાકી રકમ રા. માં** : રૂા. ૨૭,૮૭,૮૦૮.૧૬/– (રૂપિયા સત્યાવીસ લાખ સીટ્યાસી હજારે અને સાએ લો પટેલો પાદ કરા રોડી અટા ઉચ્ટ બાગે લ્ટ્રેક્ટ સુધી કરારના દરે ચડત વ્યાજ તેમજ આકરિમક ખર્ચ, કોસ્ટ અને સાર્જ વારે પ્રો છે કબજાની તારીખ : ૧૦.૮.૨૨૫ આપે સ પ્રવાર કરવાળી ત્યાર વરા દરે ચડત વ્યાર બેલ બાર તે નાળરે તે આરે તાણી ગરબાયી ગરબાય કરવાળી લારીખ : ૧૦.૮૮.૨૦૧૧

નામદેવ પામનદાસ હરવાણી (અરજદાર/દેવાદાર) અને વાશદેવી નામદેવભાઇ હરવાણી, રાજ્કુમાર, નામદેવભાઇ હરવાણી (સહ–અરજદાર/સહ ગાનદય પાતમાદાત હરપાલા ( અરગદાર[દરાદાર) અંગ પાસદયા ગામદપાનાઇ હરપાલા, દાત્રવૃતાર, ગામદપાનાઇ હરપાલા (સહ-અરગદા?તદ-દેશાદાર) તમામનું સરનામું: શિવ ભક્તિ બ્લોક નં. ૧૧, આંગાવાડી જોયોપુટા, જુલા સરસ્વતી સ્કૂલ પાસે, જુનાગઢ–૩૬૨૦૦. (૨) લોન એકાઉંટ નંબર : ૩૪૪૩૨૮૬ (૩) લો**નની રકમ રૂા. માં** : ગ્ર. ૨૫૦૦૦૦/– (રૂપિશા પરસીસ લાખ પુરા) (૪) **કિક્સો શીટીનો વિગત** : પ્લોટ નં. ૧૧ પૈકી (દક્ષિણ બાપુ)ની જમીન ૧૦૬ ચો.મી., એન.એ. રેવન્થુ સર્વે નં. ૮ પૈકી, જોયોપુરા, જુભાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશનની હદમાં, ગુજરાત રાજ્ય ખાતેની સ્થાયર મિલકતના તમામ ભાગ અંગે હિસ્સા. (૫) માંગણા **નોટીસની તારીખ :** ૨૪/૦૩/૨૦૨૧ (૬) **બાકી કદમ રૂા. માં** : રૂા. ૨૮,૮૧,૨૬૧.૨૬/– (રૂપિશા મહાવાદીસ લાખ એકરાયરી હભર બસો એકસઠ અને છલ્લીસ પૈસા પુરા) ૨૩/૦૩/૨૦૨૧ મુજબ અને વાસ્તવિક છુટકારા સુધી કરારના દરે ચડત વ્યાજ તેમજ આકસ્મિક ખર્ચ, કોસ્ટ અને ચાર્જ વગેરે. (*૭*) **કબજાની તારીખ** : ૧૦.૦૮.૨૦૨૧

. સિક્સોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાવ

. કોઇપણ વિરોધ અને સમાધાન માટે સંપર્ક: શ્રી આશિષ પરિહાર : સંપર્ક નં. ૯૭૫૩૨૫૦૫૬૭ (એરિચા લીગલ મેનેજર). શ્રી ચિરાગ ઠક્કર : સંપર્ક ે. કાર્બે કે બેલા પ્રતાન કે તે કે બેલા મેને જરે અને શ્રી પ્રશાંત માખેશ : સંપર્ક નં. ૭૬૦૦૮૦૦૯૦૦ (એરિશા ક્લેક્શન મેનેજર) એશડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ, ૪૦૪, લેન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હોલ સામે, ટિટેનિયમ સિટી સેન્ટર મોલ પાસે, આનંદનગર રોડ, સેટેલાઇટ, ઝમદાવાદ–૩૮૦૦૧૫ શ્વળઃ અમદાવાદ અને રાજકોટ અધિકૃત અધિકારી એચડીબી ફાથનાન્સિથલ સર્વિસીઝ લીમીટેડ વતી ારીખઃ ૧૨.૦૮.૨૦૨૧

### STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30<sup>™</sup>, 2021

#### (Rs. in lakhs, unless otherwise stated)

	<b>V</b>			
		Consolidat	ea results	
Particulars	Q	Year ended		
	30.06.2021 (Unaudited)	31.03.2021 (Audited)	30.06.2020 (Unaudited)	31.03.2021 (Audited)
Total Income from operations	167.87	136.59	85.89	1,120.58
Net Profit/(Loss) for the period (before tax and before share of profit of associates, joint venture)	59.01	(68.03)	48.82	672.20
Net Profit/(Loss) for the period (before tax and after share of profit of associates, joint venture accounted using equity method)	(11.67)	(69.53)	32.71	649.36
Net Profit/(Loss) for the period after tax	(38.27)	(128.91)	23.91	442.53
Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,274.99	41.13	309.48	1,471.41
Reserves (Other equity excluding revaluation reserve)				9,734.68
Equity Share Capital	820.00	820.00	820.00	820.00
Earning per Equity share: Basic and Diluted (Rs.)	(0.09)	(0.31)	0.06	1.08

Notes

Sr. No.

2

1 The above financial results were reviewed and recommended by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on August 11, 2021.

2 The Limited Review under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Reguirements) Regulation, 2015 has been carried out by the Statutory Auditors.

3 This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable

Standalone Financial information

Particulars		Year ended		
Faituais	30.06.2021 (Unaudited)	31.03.2021 (Audited)	30.06.2020 (Unaudited)	31.03.2021 (Audited)
Total Income from operations	103.02	136.59	85.89	1120.58
Net Profit/(Loss) for the period before tax	(31.08)	(68.03)	54.28	672.20
Net Profit/(Loss) for the period after Tax	(57.68)	(127.41)	45.48	465.37

5 "Till March 31, 2021 the Company accounted for its investment in the jointly controlled entity M/s. AMJ Land Developers (formerly Pudumjee G:Corp Developers) (the "Entity") in accordance with Ind AS 111 Joint Arrangements, by including the Company's share of assets, liabilities, revenues and expenses relating to its interest in the Entity in its the standalone financials. With effect from April 1, 2021, the Company invested additional capital and acquired control in the Entity, thereby making it a Subsidiary entity of the Company. Hence, w.e.f. April 1, 2021 the Company accounted for its investment the Entity in accordance with Ind AS 103, Business Combinations and Ind AS 110, Consolidated Financial Statements and discontinued the joint operation accounting. 6 The consolidated financial results include results of :-

Place: Pune

Date: August 11, 2021

Name	Relationship
AMJ Land Developers (formerly Pudumjee G:Corp Developers)	Subsidiary Company
G-Corp AMJ Land Township Private Limited (formerly G-Corp Township	Joint Venture Company
Private Limited)	
3P Land Holdings Limited	Associate Company
Biodegradable Products India Limited	Associate Company
(formerly Pudumjee Plant Laboratories Limited)	

7 The COVID-19 outbreak has developed rapidly in India and across the globe. Measures taken by the Government to contain the virus, like lock-downs and other measures, have affected economic activity and caused disruption to regular business operations. The Company has considered the possible effects that may result from the pandemic relating to COVID-19 on the carrying amounts of all assets and liabilities including receivables, loans, investments and inventories. While the Management has evaluated and considered the possible impact of COVID-19 pandemic on the financial statements, given the uncertainties around its impact on future economic activity, the impact of the subsequent events is dependent on the circumstances as they evolve.

The above is an extract of the detailed format of financial results for the quarter ended 30" June, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of Standalone and Consolidated quarterly financial results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and the Company's web site (www.amjland.com).

9 The figures for the previous period have been recast/regrouped and corrected wherever necessary to conform to current period's presentations

For and on behalf of the Board Arunkumar M. Jatia Chairman

Sd/-

૨. રીમોટ ઈ-વોટીંગ શરૂ થવાની તારીખ અને સમય : સોમવાર, ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ની સવારે ૯.૦૦ કલાકે.

રીમોટ ઈ-વોટીંગ સમાપ્ત થવાની તારીખ અને સમય : ગુરૂવાર, ૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ ની સાંજે પ.૦૦ કલાકે આ તારીખ અને સમય પછી રીમોટ ઈ-વોટીંગ કરવાની પરવાનગી નથી, રીમોટ ઈ-વોટીંગ વિકલ્પનો ઉપયોગ ન કર્યો હોય અને જે સભ્યો વાર્ષિક સામાન્ય સભામાં વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહ્યાં હશે તે સભ્યો વાર્ષિક સામાન્ય સભામાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મત આપી શકશે. એકવાર સભ્યે કોઈ રીમોટ ઈ-વોટીંગ દ્વારા મત આપી દીધો હોય તો તે વીસી/ઓએવીએમ માં ભાગ લઈ શકશે, પરંતુ તેમને વાર્ષિક સામાન્ય સભામાં કરીથી મતદાન કરવાની મંજરી મળશે નહીં.

જે વ્યક્તિએ કંપનીની વાર્ષિક સામાન્ય સભાની નોટીસ રવાના કર્યા બાદ કંપનીના શેર લીધા હોય અને કટ ઑફતારીખ (૨૭ ઓગસ્ટ, ૨૦૨૧)ના રોજ સભાષદ હોય તે વ્યક્તિ વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવેલ રીમોટ ઈ-વોટીંગની સૂચનાઓ અનુસરીને વોટીંગ કરી શકશે.

જે વ્યક્તિનું નામ સભાષદ રજીસ્ટરમાં અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સના બેનીફિસીઅલ ઓનર્સ રજીસ્ટરમાં કટ ઑફ તારીખે નોંધાયેલ હોય તે વ્યક્તિને વાર્ષિક સામાન્ય સભામાં તેમજ રીમોટ ઈ-વોટીંગ દારા મતદાન કરવાની સવિધા મળશે.

સભ્યોને ઇલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ થકી વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં દર્શાવ્યા મુજબના કામકાજ પર મત આપવાની તક મળશે. ડીમેટ સ્વરૂપમાં, ફિઝિકલ સ્વરૂપમાં શેરો ધરાવતા સભ્યો અને જેમના ઇમેઇલ આઈડી નોંધાયા નથી તેવા સભ્યો માટે વોટીંગ સમય દરમ્યાન અને વાર્ષિક સામાન્ય સભા દરમ્યાન ઇલેક્ટ્રોનિક મતદાન આપવાની પદ્ધતિ નોટીસમાં આપવામાં આવેલ છે.

જે સભ્યોએ પોતાના ઇમેઇલ આઈડી કંપની/ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાવેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા તેમજ સૂચનાઓ સહિતના તમામ સંદેશા પ્રાપ્ત કરવા માટે નીચે દર્શાવ્યા મુજબ ઇમેઇલ આઈડી નોંધાવવાનું રહેશે :

ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા હોય તે સભ્યોને વિનંતી છે ric@aiaenginering.com પર ફોલિયો નંબર, નામ અને પાન કાર્ડ અથવા તો આઘાર કાર્ડની સેલ્ફ એટટેસ્ટેડ, સ્કેન કરેલી કોપી સાથે ઇમેઇલ મોકલી પોતાના ઇમેઇલ આઈડી નોંધાવી દેવા.

બી. જે સભ્યો ડિમેટ સ્વરૂપમાં શેર ધારણ કરી રહ્યાં છે તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે પોતાનું ઇમેઇલ આઈડી નોંધાવી શકે છે.

૮. ઈ-વોટીંગ સંબંધિત કોઇ પણ પ્રશ્ન હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્પ સેકશનમાં ફ્રિકન્ટલી આસ્કડ ક્વેશ્વન્સ - "FAQs" (અવાર નવાર પુછાતા પ્રશ્નો) અને ઈ-વોટીંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા helpdesk@evotingindia.com પર ઇમેઇલ કરી શકે છે અથવા ૦૨૨-૨૩૦૫૮૭૩૮ અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૩ અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨ ૫૨ ફોન કરીને જાણકારી મેળવી શકે છે.

ઈ-વોટીંગ ને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો, શ્રી રાકેશ દળવી, સી. મેનેજર, સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ (ઇન્ડિયા) લીમીટેડ, એવિંગ, ૨૫ મો માળ, મેરેથોન ફ્યુચુરેક્ષ, મફ્તલાલ મિલ્સ કમ્પાઉન્ડ, એન.એમ.જોશી માર્ગ, લોઅર પરેલ (પુર્વ), મુંબઇ-૪૦૦૦૧૩ નો સંપર્ક ઇમેઇલ : <u>helpdesk@evotingindia.com</u> પર અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૩ અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨ ૫૨ ફોન કરીને જાણકારી મેળવી શકે છે.

૧૦.જે સભ્યો ફિઝિકલ સ્વરૂપમાં શેર ધરાવતા હોય અને ડિવિડન્ડની ૨કમ પોતાના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરાવવા માંગતા હોય, તેઓ વિનંતી પત્ર સાથે સેલ્ફ એટટેસ્ટેડ પાન કાર્ડ અને આધાર કાર્ડની કોપી, કેન્સલ્ડ ચેક અને બેન્ક પાસબુકની નકલ કંપની અથવા આર.ટી.એ.ને મોકલાવી શકે છે. જે સભ્યો ડિમેટ સ્વરૂપમાં શેર ધરાવતા હોય, તે સભ્યો તેમના સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરી શકે છે.

કંપની અધિનિયમ ૨૦૧ ૩ની ધારા ૯૧ હેઠળ સભ્યોનું રજીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક શનિવાર, તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૧ થી શુક્રવાર, તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ (બને દિવસો સહીત) બંધ રહેશે.

એઆઈએ	એન્જિનિચરીંગ લીમીટેડ વતી,
	સહી/–
<b>તારીખ</b> : ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧	એસ. એન. જેથલિયા
<b>સ્થળ :</b> અમદાવાદ	કંપની સેક્રેટરી